1945-03-17 -Balkrishna Bhaishankar Jani to Ratanshi Khimji [1038]

શ્રી ૧૧

શાસ્ત્રી બાળકૃષ્ણ ભાઈશંકર જાની નખત્રાણાવાળા

શ્રી કચ્છી પાટીદાર જ્ઞાતિના કુળગોર
અને
શ્રી કચ્છી પાટીદાર સનાતન ધર્મ
મંડળીના અધ્યક્ષ.

લુણસાવાડ,
કડીયા ત્રંબુ શેરી,
અમદાવાદ, તા. ૧૭. ૩. ૪૫.

Ref. No. ૪૯૧

સદ્‌ગુણાલંકૃત સનાતનધર્મ શિરોમણી ઉદાર-
ચરિત પટેલ શ્રી રતનશીભાઈ ખીમજીભાઈ.
મુ. અમદાવાદ. ના. શા. બાળકૃષ્ણ ભાઈશંકર
જાની ના સપ્રેમ જય શ્રી લક્ષ્મીનારાયણ વાંચશો.

લખવાનું:- મ્હારા બધા પત્રો આપને મળ્યા
હશે. કાર્યને દીવ્યસ્વરૂપ બનાવવું તે ધનિકો
ના સહકાર માંહે છે.

ઉત્તેજન આપી વ્યવસ્થીત કાર્ય થાય
તો જ. સર્વેની અભિલાષાઓ પ્રભુ પૂર્ણ કરશે.
આપ સૌને અનુભવ હશે કે:- આપણા કાર્યમાં
તન. મન. અને ધન. ના સહયોગ વિના
કર્યા પ્રયત્નો, વજુદ વિનાના બને છે. આપ
ને તારથી સૂચના પણ રૂબરૂ મળાશે.
સોમવાર તા: ૧૯-૩/૪૫ ના રોજ મોગામ ત્યાં
આવવા ધાર્યું છે. પણ તે પહેલાં જવાબ
મળવો જોઈએ. તારથી જવાબ આપશો,

Kul guru of Kutchhi Patidar community

શ્રી ૧।

શાસ્ત્રી બાળકૃષ્ણ ભાઈશંકર જાની નખત્રાણાવાળા

શ્રી કચ્છ પાટીદાર જ્ઞાતિના કુળગોર
અને
શ્રી કચ્છ પાટીદાર સનાતન ધર્મ
મંડળીના અધ્યક્ષ.

લુણસાવાડ,
કડીયા ત્રંબુ શેરી,
અમદાવાદ, તા. ૧૭. ૩. ૪૫.

Ref. No. ४८१

સદ્ગુણાલંકૃત સનાતનધર્મ શિરોમણી. ઉદાર-ચરિત. પટેલ શ્રી રતનશી ભાઈ ખીમજી ભાઈ. મુ. અમદાવાદ. ના. લી. બાળકૃષ્ણ ભાઈશંકર જાની ના સપ્રેમ જય શ્રી લક્ષ્મીનારાયણ વાંચશો।।

લખવાનું:- મ્હારા બધા પત્રો આપશ્રીને મળ્યા હશે. કાર્યને દીવ્યસ્વરૂપ બનાવવું તે ધનિકો ના સહકાર માંહે.

ઉત્તેજન આપી વ્યવસ્થીત કાર્ય બાદ લોક. હૃદયની અભિલાષાઓ જરૂર પૂર્ણ કરશે. આપશ્રીને અનુભવ હશે. કે:- આપણા કાર્યનાં તન. મન. અને ધન. ના સહયોગ વિના કાર્યો પ્રયત્નો, વજુદ વિના ના બને છે. આપે કે તારૂથી સૂચના પછે રૂબરૂ મળાશે. સોમવાર તા: ૧૯-૩/૪૫ ના રોજ મોગાન ત્યાં આવવા ધારેલ છું. પણ કે પહેલાં મને ખબર મળવી જોઈએ. તારથી ખબર આપશો,

હું સ્વારે જઈશ એટલે. તમોને વાયર કરીશ.
તે રહેજે જાણવા લાગ કહીશ? આપ લિખશો પત્ર
ઉપર નાખ્યો હશે તો મને ઉતાવળ પહોંચશે
નહીં. અને તા. ૨૧ કુંભના સોમવારે સ્વારે
જઈશ અને સ્ટેશન પરથી વાયર કરીશ.

મ્હારું તારનું સરનામું.

ત્રિકમદાસજી
ઠે. ગોકળભાઈ ત્રિવેદી
અમદાવાદ.

લિ.
બાળકૃષ્ણના
...
...

તા. ક. હું અરજી અને ફોટા સાથે
અનુગ્રહ પત્ર મોકલીશ

નિશાની :- અનુગ્રહ પાસે પત્ર ધારણ
કરેલ રહેશે.

(૧) "સરનામું" કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ઉદ્ધારક
... સંપ્રદાય આચાર્ય.

ઉપર મુજબ સાથે ફોટા ... ધારણ
કરેલ રહેશે.

આચાર્યનું
નિશાન



ત્રિપુંડની ઉર્ધ્વ ત્રિપુંડ
તેમાં ~~...~~ ચાંલ્લા
વાળું નિશાન સાથે
પાસે રહે છે.
આચાર્ય એકલા રહે તો આ નિશાન તેમના પાસે રહેશે.

જ્યોતિષ સંબંધનું ॐ દરેક કામ કરનાર

ज्योतिर्विद्‌शास्त्री बाळकृष्ण भाईशंकर याज्ञिक

हळवदवाळानुं

त्रिकालदर्शक ज्योतिष कार्यालय. अहमदाबाद.

स्थापित संवत १९८४

કામનો નંબર	આવ્યા તારીખ	તૈયાર થયા તારીખ
2990		

श्री गणेशाय नमः

कुंडली — पत्रिका — कुंडली



નામ ____________

ઠેકાણું ____________

ગામ ____________

વિગત ____________

આવ્યા તા. ____________



सूर्यः शौर्यमथेंदुरुच्चपदवीं सन्मंगळं मंगळः सद्बुद्धिं च बुधो गुरुश्च गुरुतां शुक्रः शं शनिः ॥ राहुर्बाहुबळंकरोतुविपुलं केतुः कुलस्योन्नति नित्यं प्रीतिकरा भवंतु भवतां सर्वे प्रसन्नाः ग्रहाः ॥

જ્યોતિષશાસ્ત્રાનુસાર. તા.૨૬.૩/૪૫
આવવાનું લખેલ પરંતુ તે તીથી નિર્ણય
પતાં બીજી તિથિનો નિર્ણય પતાવી
મોગામ અને જ્યોતિષ શાસ્ત્રને
માન આપી. તા. ૨૬ મી માર્ચ.૧૯૪૫
સોમવારે અહીંથી સ્વાર થવા
સંપૂર્ણ વિચાર નક્કી કર્યો.

બાળકૃષ્ણ
તા. 17-3-45

शुभं भवतु

1945-03-17 -Balkrishna Bhaishankar Jani to Ratanshi Khimji [1038]

જ્યોતિર્વિદ્ શાસ્ત્રી બાળકૃષ્ણ ભાઈશંકર યાજ્ઞિક

જગપ્રસિદ્ધ — હળવદનિવાસી

JYOTIRVID SHASTRI
Balkrishna B. Yajnik.
Trikal Darshak Jyotisha Karyalaya

ત્રિકાળદર્શક જ્યોતિષ કાર્યાલય
નંબર
અમદાવાદ (ગુજરાત)

ભુગસાવાડ.
Ahmedabad.
(INDIA)

જ્યોતિષને લગતા દરેક કાર્યો શાસ્ત્રીયપદ્ધતિથી થાય છે.
જન્માક્ષર, જન્મોત્રિ વર્ષફળ, ટપકાં વિગેરે
નડતાગ્રહોનું નિવારણ તાવીજથી તેમજ અનુષ્ઠાનથી થાય છે.
ધનપ્રાપ્તિ અને સંતાનપ્રાપ્તિની અભિલાષા પૂર્ણ કરવા માટે ચોક્કસ ઉપાયો બતાવીએ છીએ.
હસ્તરેખા તેમજ ગણીત અને ફળાદેશ વિગેરે કાર્યો ઉપર પુરતુ ધ્યાન રહે છે.
રૂ, સોનું, ચાંદી, શેર, સીંગ ડીફ્રુર્ડ વિગેરે બજાર ભાવની રૂખો યોગ્ય ચાર્જથી મળશે.
ભૃગુસંહિતાથી ગત જન્મ અને આ જન્મનું ફળાદેશ કહીએ છીએ.
એક વખત કાર્ય આપી ખાત્રી કરશો.

Ref. No. 395 — Date ૧૭.૩.૪૫

સદ્ગુણાલંકૃત. કોન્ટ્રાક્ટર.
શ્રી. રતનશીભાઈ ખીમજીભાઈ પટેલ.
વીરાણીવાળા. હાલ ઘાટકોપર

અગાઉના પત્રમાં જણાવ્યા મુજબ.
ફરજ ફરજમાંથી મુક્ત થયા સનાતન
ધર્મનો ઝંડો ધારણ કર્યો છે. વડીલોની
તેમજ પ્રભુ શ્રી લક્ષ્મીનારાયણદેવની
સંપૂર્ણ પ્રસન્નતાથી. ફરજ બજાવી
જીવન અર્પણ કરવું છું મ્હારી આ
શુભ પ્રવૃત્તિમાં અર્ધાંગીની પણ
સંપૂર્ણ સહમત હોઈ, પ્રસંગે ધાર્મિક
વિવેચનોનો લાભ. સન્નારીઓને.
આપી તેમનું જીવન તેજોમય બને.
ઉપરોક્ત કાર્યોવસાત બીજી તમામ
પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધી છે. પ્રભુ.
ઈચ્છાથી રાજ્ય રજવાડાઓ શેઠ.
શાહુકારો. તે. બા. લોર્ડલીનલીથગો. બા.
વડોદરા નરેશ સર્વેને જ્યોતિષ કાર્ય
આબાદ અને પ્રશંશાનીય પૂર્વક
આપેલા છે.

ધર્મની ધગશ. અને સમયનું અકલાતું રૂપાંતર, માં હાઈ: પ્રભુ ઈચ્છાપ્રમાણે સનાતન ધર્મની મહાન પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. મને સંપૂર્ણ આશા છે. કે:- આપ સૌ નો સહકાર મ્હારા કાર્યમાં કોઈ દિવ્ય સ્વરૂપ થી તેજોમય નિવડશે.

બાલકૃષ્ણ ના
જય શ્રી [illegible]